

AHASOLAR/2023-24/17

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400 001,
MH,IN.

Date: 05.09.2023

BSE Scrip Code:-543941

Sub.:- Newspaper Advertisements – Notice of 6th Annual General Meeting, Intimation of Record Date and E-voting information etc.

Dear Sir/ Madam,

Please find attached herewith copies of newspaper advertisements published in the Financial Express (English) & (Gujarati), both newspapers having electronic editions, regarding notice of 6th Annual General Meeting, intimation of Record Date for e-Voting information in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record.

Thanking you.

**Yours faithfully,
For, Ahasolar Technologies Limited**

Piyushkumar Vasantlal Bhatt
Chairman & Managing Director
DIN: 06461593

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

DCB BANK

Whereas, the undersigned being the Authorized Officer of DCB Bank Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (and 3 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09.12.2019 calling upon **AKBARALI JAFARALI SAYAD AND AISHA AKBARALI SAYAD** to repay the amount, mentioned in the notice being Total Rs. 30,33,887.00/- (Rupees Thirty Lakh Thirty Three Thousand Eight Hundred Eighty Seven Only) on 08.12.2019 borrowed through DCB Bank Limited within 60 days from the date of the said notice.

The borrower as well as the guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor in particular and the public in general that the under signed has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said ordinance read with the Rule 9 of the said rule on this 31 day of Aug of the year 2023.

The borrower/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of DCB Bank Limited, for an amount Rs. 30,33,887.00/- (Rupees Thirty Lakh Thirty Three Thousand Eight Hundred Eighty Seven Only) on 08.12.2019 in loan account number DAHLKAD00455454 and payable with further interest thereon until payment in full. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

PLOT NO. 63, BLOCK NO. 65, R.S. NO. 823, OPP. MAHARAJA COMPLEX NR. KADODARA POLISH CHOKI, MOJE: KADODARA, TA. PALSANA, DI. SURAT, SURAT.

Date: 31/08/2023
Place: SURAT

Sd/-
Authorized Officer

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

DCB BANK

Whereas, the undersigned being the Authorized Officer of DCB Bank Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (and 3 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 19.12.2022 calling upon **BHUPENDRA KALIDASBHAI SOLANKI AND DIPKABEN BHUPENDRA SOLANKI** to repay the amount, mentioned in the notice being Total Rs. 5,25,577.37/- (Rupees Five Lakh Twenty Five Thousand Five Hundred Seventy Seven Rupees and Thirty Seven Paise only) as on 19.12.2022 borrowed through DCB Bank Limited within 60 days from the date of the said notice.

The borrower as well as the guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor in particular and the public in general that the under signed has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said ordinance read with the Rule 9 of the said rule on this 20 day of Aug of the year 2023.

The borrower/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of DCB Bank Limited, for an amount Rs. 5,25,577.37/- (Rupees Five Lakh Twenty Five Thousand Five Hundred Seventy Seven Rupees and Thirty Seven Paise only) as on 19.12.2022 in loan account number DRMBVAD00407102 and payable with further interest thereon until payment in full. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

IMMOVABLE PROPERTY BEARING PROPERTY NO. A/27 PAKI WEST SIDE OF HARAJI SOCIETY, REVENUE SURVEY NO. 263, CITY SURVEY NO. 157 MOJJE VILLAGE SAVAJIPURAF OF SUB DISTRICT VADODARA SECTION-5, PIN 360119.

Date: 05/09/2023
Place: VADODARA

Sd/-
Authorized Officer

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

DCB BANK

Whereas, the undersigned being the Authorized Officer of DCB Bank Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (and 3 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 19.04.2021 calling upon **SAGLANI BHAVESH PRABHUDAS AND SAGLANI KUNDANBEN PRABHUDAS & SAGLANI PRABHUDAS & SHREELI PASTI BHANDAR** THROUGH ITS AUTHORIZED SIGNATORY **SAGLANI BHAVESH PRABHUDAS** to repay the amount, mentioned in the notice being Total Rs. 23,51,997.32/- (Rupees Twenty Three Lakh Fifty One Thousand Nine Hundred Ninety Seven and Thirty Two Paise only) as on 16.04.2021 borrowed through DCB Bank Limited within 60 days from the date of the said notice.

The borrower as well as the guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor in particular and the public in general that the under signed has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said ordinance read with the Rule 9 of the said rule on this 02 day of Sep of the year 2023.

The borrower/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of DCB Bank Limited, for an amount Rs. 23,51,997.32/- (Rupees Twenty Three Lakh Fifty One Thousand Nine Hundred Ninety Seven and Thirty Two Paise only) as on 16.04.2021 in loan account number DRCP/SUR0477453 and payable with further interest thereon until payment in full. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

(1) PROPERTY BEARING SHOP NO. 3 ON THE GROUND FLOOR ADMEASURING 99 SQ.FT. I.E. 9.20 SQ.MTRS CARPET AREA, ALONG WITH UNDIVIDED SHARE IN THE LAND OF "NAND PALACE" SITUATED AT SHIT NO.61, CITY SURVEY NO.205, 206,207, 209,210, 211, 212, 213,214, NONDH NO.404 ADMEASURING 264.6596 SQ.MTRS MOJE ADJANI CITY OF SURAT.

(2) PROPERTY BEARING SHOP NO. 4 ON THE GROUND FLOOR ADMEASURING 99 SQ.FT. I.E. 9.20 SQ.MTRS CARPET AREA, ALONG WITH UNDIVIDED SHARE IN THE LAND OF "NAND PALACE" SITUATED AT SHIT NO.61, CITY SURVEY NO.205,206, 207,209, 210, 211,212,213,214, NONDH NO.404 ADMEASURING 264.6596 SQ.MTRS MOJE ADJANI CITY OF SURAT.

Date: 02/09/2023
Place: SURAT

Sd/-
Authorized Officer

VASTRAPUR BRANCH: A-9,10, Ratnaker Nine Square, Vastrapur, Ahmedabad-380015, Gujarat, India

EMAIL: VASTRA@bankofbaroda.com
WEB: www.bankofbaroda.com

APPENDIX-IV POSSESSION NOTICE [See Rule 8(1)]

(for Immovable property)

Whereas the undersigned being the Authorized Officer of Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated **17.02.2020** calling upon the borrower **Smt. Premilaben Janakumar Soni** to repay the amount mentioned in the notices aggregating **Rs. 14,12,970/- (Rupees Forteen Lacs Twelve Thousand Nine Hundred Seventy only)** with further interest thereon as mentioned in the notice, till the date of payment of incidental expenses, costs, charges incurred / to be incurred less recovery within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Mortgagor / Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Mortgagor / Guarantors and the public in general that the undersigned is in **Physical possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 and in compliance of Hon'ble CMM Ahmedabad order dated 28.01.2022 under section 14 of the said Act on this the **03rd day of September of the year 2023.**

The Borrower / Mortgagor / Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the **Bank of Baroda** for an amount **Rs.14,12,970/- (Rupees Forteen Lacs Twelve Thousand Nine Hundred Seventy only)** with further interest thereon as mentioned in the notice, till the date of payment of incidental expenses, costs, charges incurred / to be incurred less recovery.

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of property owned by Smt. Premilaben Janakumar Soni being flat No B/306, admeasuring about 68 sq yards, i.e. 56.94 sq. mtrs on 3rd floor, together with undivided share on land in the Block B in the scheme known as Ratna Raj Residency, from the land bearing survey no 584/3, Draft TP scheme no 107, Final plot No 50-3, New Maninagar, Village/raje/Ramaj, (New Maninagar), Taluka Vatva, within the limit of registration district Ahmedabad and sub-district Ahmedabad-11-Ashali, and bounded as: By East: Block No A, By West: Flat No B/303, By North: Flat No B/305, By South: Flat No B/301 and Stair.

Sd/-
Authorized Officer
Bank of Baroda

Date : 03.09.2023, Place : Ahmedabad

AYM SYNTAX LIMITED

CIN: L99999DN1983PLC000045

Regd. Office: Plot no. 1, Survey No.374/1/1 (P), Village Saity, Silvassa-396230 U.T. of Dadra & Nagar Haveli. Tel: +91-22-61637000

Website: www.aymsyntax.com Email id: complianceofficer@aymgroup.com

NOTICE

1. Notice is hereby given that the 40th Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, September 29, 2023 at 12:00 Noon through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), "without the presence of members at a common venue" to transact the business as mentioned in the notice convening the said AGM. The AGM shall be held in accordance with the General Circular No 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "General Circulars") companies are allowed to hold their AGM through video conferencing/ Other Audio Visual Means (OAVM) and relaxed certain provisions related to the Annual Report. In furtherance to the above general circulars read with the applicable provisions of the Companies Act, 2013 (the "Act") and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as amended from time to time. The said Circulars have also allowed the Companies to dispense with the requirement of dispatching the physical copies of Notice of the AGM and Annual Report.

2. The Notice of the AGM and the Annual Report of the Company for the financial year 2022-23 shall be sent to the members only in electronic mode to those Members, whose names appear in the Register of Members/Beneficial Owners as on the date of the said Friday, August 25, 2023 and whose email addresses are registered with the Company / Depository Participant(s). The aforesaid documents will also be available on the Company's website at www.aymsyntax.com and on the website of BSE Limited (BSE) at www.bseindia.com and on National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com. The same is also available of the website of National Securities Depository Limited (NSDL) i.e on www.evoting.nsdl.com. Necessary arrangements have been made by the Company with NSDL to facilitate remote e-voting and e-voting during AGM.

3. Members who hold shares in physical mode and have not registered / updated their email addresses with the Company, are requested to register / update the same by writing to the Company at complianceofficer@aymgroup.com, or to the RTA at mt.helpdesk@inkintime.co.in providing Folio No., Name of member, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar card), E-mail ID and Mobile No., etc.

4. Members who hold shares in dematerialised mode and have not registered / updated their email addresses with their Depository Participants, are requested to register / update their email addresses and Mobile no. with the Depository Participants with whom they maintain their demat accounts.

5. Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialised mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the 40th AGM. The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will only be able to vote at the AGM.

6. Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM through VC / OAVM, manner of casting vote through remote e-voting or through e-voting system during the AGM. Members may contact Company secretary at complianceofficer@aymgroup.com for any grievances related to e-voting. Members participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Act.

For AYM Syntax Limited
Sd/-
Ashitosh Sheth
Company Secretary & Compliance Officer

Date: 5th September, 2023
Place: Mumbai

Vital Chemtech Limited
(Formerly Known as Vital Chemtech LLP)

CIN:- L24299GJ2021PLC127538

Registered Office: B-406, Mondeal Heights, Opp. Karnavati Club, S. G. Highway, Ahmedabad - 380015 • Telephone: +91 79 46005840; • Website: www.vitalgroup.co.in • Email: compliance@vitalgroup.co.in

NOTICE OF THE 2ND ANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING:

NOTICE is hereby given, the Second (2nd) Annual General Meeting (AGM) of the Members of Vital Chemtech Limited be held on Wednesday, September 27, 2023 at 04:00 PM, through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 2nd AGM.

In accordance with the General Circular No. 10/2022 dated December 28, 2022, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars") the Notice of AGM along with Annual Report 2022-23 has been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/Depositories. Member may note that Notice and Annual Report 2022-23 will be uploaded on the website of the Company at www.vitalgroup.co.in website of NSE India Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 2nd AGM and Annual Report 2022-23 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to compliance@vitalgroup.co.in
- In case shares are held in DEMAT mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to compliance@vitalgroup.co.in
- Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by providing the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 2nd AGM and Annual Report 2022-23 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 2nd AGM.

In case of any queries, shareholder may write to the Company at compliance@vitalgroup.co.in. Shareholders are requested to register/ update their Email IDs with their Depository Participant(s) with whom they maintain their DEMAT accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Wednesday, September 20, 2023 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Sunday, September 24, 2023 and will end on 5:00 P.M. on Tuesday, August 26, 2023. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that (a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolutions is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility of e-voting shall be made available at the 2nd AGM; and (c) the members who have cast their vote by remote e-voting prior to the 2nd AGM may also attend the 2nd AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 2nd Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Wednesday, September 20, 2023, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 and send a request at evoting@nsdl.co.in. Members may also contact Mr. Utsav Sudhir Trivedi, Company Secretary of the Company at the Registered office of the Company or may write an e-mail to compliance@vitalgroup.co.in, or may call on +91 79 46005840 for any further clarification.

MEMBERS CAN ATTEND AND PARTICIPATE IN THE ANNUAL GENERAL MEETING AT THE THROUGH VC/OAVM FACILITY. THE INSTRUCTIONS FOR JOINING THE ANNUAL GENERAL MEETING THROUGH VC/OAVM ARE PROVIDED IN THE NOTICE OF THE ANNUAL GENERAL MEETING. IN CASE THE SHAREHOLDERS/MEMBERS HAVE ANY QUERIES OR ISSUES REGARDING PARTICIPATION IN THE AGM, YOU CAN WRITE AN EMAIL TO EVOTING@NSDL.CO.IN OR CALL US - TEL: 1800-222-990. MEMBERS ATTENDING THE MEETING THROUGH VC/OAVM SHALL BE COUNTED FOR THE PURPOSES OF RECKONING THE QUORUM UNDER SECTION 103 OF THE COMPANIES ACT, 2013.

For, VITAL CHEMTECH LIMITED
Sd/-
Mr. Vipul J Bhatt
Chairman and Managing Director
DIN: 06716658

Place: Ahmedabad
Date: September 04, 2023

RIDDHI SIDDDHI GLUCO BIOLS LIMITED

CIN: L24110GJ1990PLC013967

Regd. Office: 10, Abhisree Corporate Park, Nr. Swagat Bungalws BRTS Busstand, Ambali-Bopal Road, Ambali Ahmedabad, Gujarat-380 058

Phone: 02717-29800-802, Email: ahm@riddhisiddhi.co.in, Website: www.riddhisiddhi.co.in

NOTICE OF THE 32ND ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, (Act) the Register of Members and Share Transfer Books of the Company will remain closed from **Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive)** for the purpose of 32nd AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote by 'Remote e-voting' and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said 32nd AGM Notice dated 11.08.2023.

Members may further note that:

- The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on **Tuesday, 19th September, 2023 (cut-off date)**.
- The remote e-voting period commences on **Saturday, 23rd September, 2023 at 9.00 a.m.** and will end on **Monday, 25th September, 2023 at 5.00 p.m.** During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter.
- The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.
- Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
- The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date i.e. Tuesday, 19th September, 2023; may obtain login Id and password by sending a request over email at evoting@nsdl.co.in mentioning demat account number/folio number, PAN, name and registered address. However, Members who are already registered with NSDL for e-voting can use their existing User Id and Password for casting their vote through remote e-voting/evoting at the AGM.

In case you have any queries or issues, you may refer the Frequently Asked Questions ("FAQs") for Shareholders and e-voting user manual for Shareholders at the download section of www.evoting.nsdl.com or contact Mrs. Sarita Mote (Assistant Manager) at evoting@nsdl.co.in or call on toll - free no. 022 - 4886 7000 and 022 - 2499 7000.

For, Riddhi Siddhi Gluco Biols Limited
Sd/-
Sharad Jain
Company Secretary
Mem. No. A57221

Place: Ahmedabad
Date: 04.09.2023

R & B DENIMS LIMITED

(CIN : L17120GJ2010PLC062949)

Regd. Office : Block No. 467 Sachin Palsana Road, Palsana Surat - 394315 • Telephone : +91 96012-81648, Website : www.rbdenims.com • Email : info@rbdenims.com

AGM NOTICE

Notice is hereby given that the 13th Annual General Meeting of the Members of R & B DENIMS LIMITED will be held on Friday, 29th September, 2023 at 03:00 P.M. at the registered office of the company situated at Block No.467 Sachin Palsana Road, Palsana Surat - 394315, Gujarat to transact the Business as set out in the Notice of AGM.

BOOK CLOSURE NOTICE AND E-VOTING

All the shareholders of the company are informed that the member's register of the company will be closed from Saturday 23rd September, 2023 to Friday 29th September, 2023 (both days inclusive) for the purpose of AGM. The Cut-off date for providing E-voting is 22nd September, 2023. All the members are hereby informed that:

- Electronic copies of the Notice of AGM have been sent to all the members whose email IDs are registered with the Company/ Depository Participant(s). The same is available on the Company's website www.rbdenims.com. The dispatches of Notice of AGM have been completed.
- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 22nd September 2023, may cast their vote electronically on the business set out in the Notice of AGM through electronic voting system of NSDL from a place other than the venue of AGM ("remote e-voting"). All the members are informed that:
 - The Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means;
 - The remote e-voting shall commence on Tuesday, the 26th September, 2023 at 09.00 a.m. (IST);
 - The remote e-voting shall end on Thursday, the 28th September, 2023 at 05.00 p.m. (IST);
 - The cut-off date for determining the eligibility to vote by electronic means at the AGM is 22nd September 2023.
 - Any person, who acquires shares of the company and become member of the company after the dispatch of the notice of AGM and holding shares as of the cut-off date i.e. 22nd September, 2023 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote;
 - Members may note that: (a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility for voting through ballot paper shall be made available at the AGM; (c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and (d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of e-voting as well as voting at the AGM through ballot paper;
- In case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads sections of <https://www.evoting.nsdl.com> or contact NSDL at the following toll-free no.: 022 - 48867000 and 022 - 2499 7000.

For, R & B DENIMS LIMITED
Sd/-
Rajkumar Borana
Managing Director
(DIN: 01091166)

Place : Surat
Date : 04-09-2023

INDIAN BANK

Zonal Office, Rajkot
201, Central Block, Twin Star, 150 feet Ring Road, Nr. Nava Mava Circle, Rajkot-360005.
Email : zorajkot@indianbank.co.in

APPENDIX-IV [Rule 8(1)] Possession Notice (For Immovable Properties)

Whereas the undersigned being the authorized Officer of the **Indian Bank (erstwhile Allahabad Bank)** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice on the date mentioned against each account calling upon the respective Borrowers/ Guarantors/ Mortgagor to repay the amount as mentioned against each account within 60 days from the date of notice(s)/date of receipt of the said notice(s).

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the borrowers/guarantors/mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 & 9 of the said rules on the dates mentioned against each account.

The borrowers/Guarantors/Mortgagor in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of the **Indian Bank (erstwhile Allahabad Bank)**, for the amount and interest thereon as per loan agreement.

"We draw attention to the provisions of Section 13(8) of the SARFAESI Act and the Rules framed there under which deals with your rights of redemption over the securities".

Sr. No.	Name of the Borrower / Guarantor & Mortgagor and Branch Name	Demand Notice Date / Amount	Date of Possession Notice	Description of the Property/ies Mortgaged
1.	Mr. Premji Shivji Pindoriya (Borrower and Mortgagor) Mr. Ramesh Parbat Dabasiya (Guarantor) and Mr. Rajesh Shamji Patel (Guarantor) Branch : Bhuj	Demand Notice Date : 02.06.2023 Rs. 10,37,508.08 (Rupees Ten Lakh Thirty Seven Thousand Five Hundred Eight and Paise Eight Only)	29.08.2023	All that pieces and parcel of Residential 2nd floor, Flat no.-A, Plot no.10, Hari Darshan Apartment, R.S NO 32/1P, Village- Mirzapar, Tal- Bhuj, Dist- Kutch, State- Gujarat-370001. Total built up area of the property is 47.00 Sq. Meters. S.No: allotment cum transfer Deed No. 332 (as per tile deed), dated 12.01.2015. Boundaries (as per Mortgage deed) : North : Main door in common passage, South : Open space, East : Open space, West : Flat No. B. Owner of The Property: Mr. Premji Shivji Pindoriya.
2.	Mr. Raju Ratiram Prajapati (Borrower and Mortgagor) Mr. Rajubhai Ramswarup Chorasaya (Guarantor) Branch : Madapar	Demand Notice Date : 30.05.2023 Rs. 8,57,456.00 (Rupees Eight Lakh Fifty Seven Thousand Four Hundred and Fifty Six Only)	29.08.2023	All that Pieces and parcel of Residential House situated at - Sub Plot No.26/A of Plot No.26, R.S. No.218/2, Gururupa Residency, Behind Hotel Bhavani, Junavav, Madhapar, Tal - Bhuj, Dist - Kutch, State-Gujarat Pin-370020 admeasuring (50.00 sq meters), Boundaries: North : Sub Plot No 26/B, South : Common Plot, East : Sub Plot No.26/C, West : Internal Road. Owner of the property: Mr. Raju Ratiram Prajapati
3.	Mr. Ramesh Ladharam Garva (Borrower and Mortgagor), Mrs. Aruna Ramesh Garva (Co-Borrower) and Mr. Jatubha Satubha Rathod (Guarantor) Branch : Bhuj	Demand Notice Date : 02.05.2023 Rs. 14,44,409.78 (Rupees Fourteen Lakh Forty Four Thousand Four Hundred Nine and Paise Seventy Eight Only)	29.08.2023	All that Pieces and parcel of Residential Building situated at Survey No. 98/1, plot no 103-105/6, Hirani Park, Taluka-Bhuj, Dist-Kutch, admeasuring (106.25 sq meters). Boundaries : North : 9 Meter Road, South : Sub Plot No 4 Of Plot No. 103 to 106, East : 7.5 Meter Road, West : Plot No. 121. Owner of the property: Mr. Ramesh Kumar Ladharam Garva.
4.	Mrs. Vanitaben Pareshbhai Humal (Borrower & Mortgagor), Mr. Paresb Valji Humal (Borrower & Mortgagor) & Mr. Yogeshkhanth Devkanthad Goswami (Guarantor) Branch : Madapar	Demand Notice Date : 31.05.2023 Rs. 12,98,862.12 (Rupees Twelve Lakh Ninety Eight Thousand Eight Hundred Sixty Two and Paise Twelve Only)	29.08.2023	All that Pieces and parcel of Residential House situated at - Plot No.32, R.S. No.141/1 Paiki 2, Maruti Plots, Navavav, Madhapar, Tal - Bhuj, Dist - Kutch, State-Gujarat Pin-370020 admeasuring (83.87 sq meters). Boundaries: North : Plot No. 31, South : Plot No. 33, East : 7.50 Meter Wide Internal Road, West : Land Survey No. 141/1 Paiki Owner of the property: Mrs. Vanitaben Pareshbhai Humal & Mr. Paresb Valji Humal

Date : 29.08.2023, Place : Madhapar, Bhuj
Authorized Officer, Indian Bank

FORM NO. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI [Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

1) Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Central Registration Centre(CRC) that **M/s. PARMESHWAR RESTAURANT PARTNERSHIP FIRM** a Partnership Firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

2) The principal objects of the company are as follows:
To develop, promote, establish, own, acquire, operate, manage and maintain directly or indirectly, restaurants and Hotel for providing Room Facility for Stay (including quick service restaurants), eating houses, kiosks, fast food outlets, cafeterias, food courts, tea and coffee houses, soda, canteens, catering services or other store formats and provide therein all types of amenities, facilities, conveniences, refreshments, in the territory of India and to license to other franchisees as a master franchisee, the right to develop, establish, operate and maintain, restaurants, eating houses, kiosks, fast food outlets, cafeteria, food courts, tea and coffee houses, soda fountains, catering services or other store formats in particular locations or regions within the territory of India.

3) A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at Survey No. 407, Nr. Basera Party Plot, Sardar Patel Ring Road, Ambali Ahmedabad-380058.

4) Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at, Central Registration Centre (CRC), India Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8 Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code - 122050, within twenty-one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated This 5th Day of September, 2023

Name(s) of Applicant
1. Mohil Patel
2. Yashpaibhai Bhabhubhai Khachar

AHASOLAR TECHNOLOGIES LIMITED

CIN: U74999GJ2017PLC098479

Regd. Office: Office No. 207, Kalasagar Shopping Hub, Opp. Saibaba Temple, Sattadhar Cross Road, Ghatodiya, Ahmedabad, Gujarat, India-380061

Ph. : 079-40394029 | E-Mail: compliance@ahasolar.in | Website: www.ahasolar.in

NOTICE OF 6TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Six Annual General Meeting (AGM) of the Company will be held on Friday, September 22, 2023 at 11:00 a.m. (IST) through video conferencing ("VC") other audio visual means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM. The Company has sent the Notice of AGM along with Annual Report for Financial Year 2022-23 on 29th August, 2023, only through electronic mode, to the Members whose e-mail id were registered with the Company/Depositories, in accordance with the Circulars issued by Ministry of Corporate Affairs dated May 5, 2020 read with its circulars dated April 08, 2020, April 13, 2020, January 13, 2021, December 14, 2021, May 5, 2022 and December 28, 2022 and SEBI circular dated May 12, 2020, January 15, 2021, December 08, 2021, May 13, 2022 and January 05, 2023.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI(LODR) Regulations, 2015 and Secretarial Standards on General Meetings ("SS2") issued by Institute of Company Secretaries of India, members are provided with facility to cast their vote on all the resolutions set forth in the said Notice, using electronic voting system (e-voting) provided by National Securities Depository Limited (NSDL). The voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Friday, 15th September, 2023 ("cut-off date"). The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given below:

- The Book Closure period shall commence on 16th September, 2023 and end on 22nd September, 2023 (Both Days Inclusive);
- The remote e-voting shall commence on Tuesday, 19th September, 2023 at 09:00 a.m. (IST) and end on Thursday, 21st September, 2023 at 05:00 p.m. (IST);
- Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, 15th September, 2023;
- The members will not be allowed to vote through remote e-voting beyond the period as specified above;
- Shareholder acquiring the shares of the Company and becomes Members of the Company after sending of the Notice and holding Shares as of the Cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights;
- E-voting facility will be available during the AGM. Members who have cast their votes by remote e-voting on

